

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સેવાના સુધારા સપ્ટેમ્બર ૩થી અમલી

બ્રેમ્પટન, ઓન્ટારિયો (૦૯ ઓગસ્ટ ૨૦૧૯) – ૦૩ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સમયપત્રકમાં અનેક સુધારા લાગુ કરશે અને બે નવા રૂટ્સ ઉમેરશે – ૨૮ વાનલેસ (Wanless) અને ૮૧ મેફિલ્ડ વેસ્ટ (Mayfield West) – અને એક નવી સેવા ૫૦૦ ગોર રોડ (Gore Road).

રૂટ ૨૮ વાનલેસ (Wanless)

રૂટ ૨૮ વાનલેસ વિકાસ પામતા માઉન્ટ પ્લેઝન્ટ નેબરહૂડને સેવા આપશે, જ્યાં તે માઉન્ટ પ્લેઝન્ટ GO સ્ટેશનથી હુરોન્ટારિયો સ્ટ્રીટ, વાનલેસ ડ્રાઈવના દક્ષિણ સુધી ચાલશે. પ્રવર્તમાન માઉન્ટ પ્લેઝન્ટનાં રૂટ્સ – રૂટ્સ ૨૬ માઉન્ટ પ્લેઝન્ટ (Mount Pleasant) અને ૨૭ રોબર્ટ પાર્કિન્સન (Robert Parkinson) – ને પુનઃનિર્મિત કરાશે જેથી સમુદાયને વધુ સેવાથી આવરિત કરી શકાય જેમાં વધારાની સપ્તાહનાં અંતિમ દિવસોની સેવા હશે.

રૂટ ૮૧ મેફિલ્ડ વેસ્ટ (Mayfield West)

રૂટ ૮૧ મેફિલ્ડ વેસ્ટ બ્રેમ્પટનથી કેલેડન સુધી સેવા આપશે. તે સેન્ડલવૂડ લૂપ (Sandalwood Loop) અને સાઉથફિલ્ડ્સ વિલેજ નેબરહૂડ(Southfields Village neighbourhood)માં સ્થિત કેનેડી રોડ (Kennedy Road) પર ન્યુહાઉસ બૂલેવર્ડ/બોનિગલેન ફાર્મ (Newhouse Boulevard/Bonnieglan Farm) સુધી ચાલશે.

રૂટ ૫૦૦ ગોર રોડ

રૂટ ૫૦૦ ગોર રોડ સવારીઓના વિકાસાર્થે મદદરૂપ થવા માટેની નવી સેવા છે ખાસ કરીને અઠવાડિયાના ચાલુ દિવસોમાં સૌથી વધુ યાતાયાતના સમયગાળામાં, અને હમ્બર કોલેજ(Humber College)ની સવારીઓ માટે. સફરો ગોર મેડોઝ કમ્યુનિટી સેન્ટર અને હમ્બર કોલેજ વચ્ચે ચાલુ અઠવાડિયાના દિવસોમાં સવારે મહત્તમ યાતાયાતના સમયે ચાલશે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પ્રવર્તમાન સમયપત્રકોમાં અને સેવાના આવર્તનોમાં પણ સુધારો લાવશે જેથી સવારીઓ અને જોડાણોના વધારાઓને મદદરૂપ થઈ શકે જેમાં સામેલ છે નવી સાત મિનિટના આવર્તન સાથે 502 ઝૂમ મેઈન ચાલુ અઠવાડિયાના દિવસોમાં સવારે, અને પાંચ મિનિટની સેવા પશ્ચિમ તરફ યોર્ક યુનિવર્સિટી (York University) થી 501A/501C ઝૂમ ક્વિન (Züm Queen).

નવા રૂટ્સની માહિતી અને સમયપત્રકોનું પૂર્વાવલોકન www.bramptontransit.com પર મળી રહેશે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સેવા માહિતી બ્રોશર – રીડ એન્ડ રાઈડ (Read & Ride) – આ સપ્તાહના અંતિમ દિવસોમાં તેમની ક્લાર્ક (Clark) અને સેન્ડલવૂડ (Sandalwood) સવલતો પર અને બસોની અંદર ઉપલબ્ધ રહેશે. રીડ એન્ડ રાઈડ (Read & Ride) અને રાઈડર ગાઈડ (Rider Guide) (સિસ્ટમ મેપ) ઓગસ્ટ 26થી શરૂ થતા સપ્તાહની શરૂઆતમાં ટર્મિનલો પર ઉપલબ્ધ થશે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સ્ટાફ આવી રહેલા સેવાના સુધારા વિશે સવારીઓ સાથે પ્રવૃત્ત થવા માટે ઓગસ્ટ 26 થી સપ્ટેમ્બર 6 સુધી ટ્રાન્ઝિટ ટર્મિનલ્સ પર હાજર રહેશે.

સપ્ટેમ્બરની સેવાના સુધારા વિશે વધુ માહિતી માટે બ્રેમ્પટન ટ્રાન્ઝિટને 905.874.2999 પર કૉલ કરો અથવા www.bramptontransit.com ની મુલાકાત લો.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ન્યુઝ વિશે અને જાહેરાતો વિશે અદ્યતન રહેવા માટે બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ઈ-ન્યુઝલેટર માટે સાઈન અપ અહીં કરો www.bramptontransit.com. બ્રેમ્પટન ટ્રાન્ઝિટ (Brampton Transit)ને Twitter, Facebook, અને Instagram પર @BramptonTransit ને ફોલો કરો.

-30-

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca